




અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સદન

જાહેરખબર ક્રમાંક : ૮ થી ૧૦ / ૨૦૧૫-૧૬ ની પરીક્ષા બાબત



સંદર્ભ :- સીનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટની ૪૦% પ્રમાણેની જગ્યા સીધી ભરતીથી ભરવા બાબત ગુજરાત હાઇકોર્ટ SCA No. 1588/2016

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓમાં વહીવટી સંવર્ગમાં સીનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટની ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ જાહેરખબર ક્રમાંક : ૮ થી ૧૦ / ૨૦૧૫-૧૬ તા.૩૧/૧૨/૨૦૧૫થી જાહેરખબર પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. જેની ઓનલાઇન પરીક્ષા તા. ૦૨/૧૨/૨૦૧૬ નારોજ અમદાવાદ ખાતે રાખવામાં આવેલ. જે અંગે પ્રાથમિક ચકાસણીમાં ક્વોલિફાઇડ થયેલ તમામ ઉમેદવારોને ઓનલાઇન જાણ કરવામાં આવેલ છે. સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓ અને રોસ્ટરની માહિતી નીચે મુજબ છે.

ક્રમ	જગ્યા નું નામ/ જાતિ	S.C	S.T	SEBC	PH	GEN	સીધી ભરતીથી ભરવાની કુલ જગ્યા
૧	ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ	૦૪	૦૮	૧૬	૦૧	૩૧	૬૦
૨	સહાયક હેડ ક્લાર્ક	૦૪	૦૮	૧૭	૦૧	૩૫	૬૫
૩	સહાયક સીનીયર ક્લાર્ક	૧૮	૪૧	૭૪	૦૮	૧૩૫	૨૭૬

ઉક્ત જાહેરખબર સામે અમ.મ્યુ.કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં SCA No. 1588/2016 થી ૧૦૦% પ્રમોશન થી જગ્યાઓ ભરવા દાદ માંગવામાં આવેલ. જે અંતર્ગત ફરીથી ગુજરાત હાઇકોર્ટમાં CA No. 1/201૮ થી તા. ૦૨/૧૨/૨૦૧૬ ના રોજ યોજનાર પરીક્ષા ઉપર સ્ટે મુકવા અંગે દાદ માંગવામાં આવેલ જે અંતર્ગત તારીખ ૩૦/૧૧/૨૦૧૬ ના રોજ નામદાર હાઇકોર્ટ દ્વારા ઇન્ટરીમ ઓર્ડર પસાર કરેલ છે જેમાં નામદાર હાઇકોર્ટે તારીખ ૦૨/૧૨/૨૦૧૬ ના રોજ યોજનાર ઓનલાઇન પરીક્ષા લેવા અંગે કોઇ સ્ટે આપેલ નથી તેમજ પરીક્ષાનું રીઝલ્ટ પ્રસિદ્ધ ન કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવેલ છે વધુમાં પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર દરેક ઉમેદવારને સદર હાઇકોર્ટ મેટર અંગે જાણ કરવા તથા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેથી સદરહું જગ્યાઓ માટે કોઇ હક્ક દાવો ઉપસ્થિત થશે નહી તથા પરીક્ષાનું પરિણામ સદર કોર્ટ મેટરના ચુકાદા અન્વયે બંધનકર્તા રહેશે તેવી જાણ કરવા હુકમ કરેલ છે આમ સદર ભરતી પ્રક્રિયા ઉપરોક્ત બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટનો જે પણ નિર્ણય આવે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

ઉપરોક્ત બાબતની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.

તારીખ :- ૦૧/૧૨/૨૦૧૬

અ.મ્યુ.કો.દ્વારા પ્રકાશિત